

AE-130
April-2023
B.Sc., Sem.- VI
CC-310 : Zoology

Time : 2:30 Hours]

[Max. Marks : 70]

સૂચનાઓ : (1) બધા જ પ્રશ્નો ફરજીયત છે.
(2) જરૂર જણાય ત્યાં સ્વર્ચષ, નામ નિર્દેશનવાળી આકૃતિ સહ ઉત્તર આપો.

- | | | |
|-------------|---|---|
| 1. | (i) પ્રાણી શરીરમાં વિષ પ્રવેશવાના માર્ગ સમજવો. | 7 |
| | (ii) ટોક્સીસિટીને અસરકર્તા કોઈપણ ચાર પરિબળો વર્ણવો. | 7 |
| અથવા | | |
| | (i) ક્લીનિકલ અને એન્વાયરમેન્ટલ ટોક્સીકોલોજી સમજવો. | 7 |
| | (ii) એક્ઝ્યુટ ટોક્સીસિટી વર્ણવો. | 7 |
| 2. | (i) પેશી સંવર્ધનમાં એન્ટીબાયોટિક, બફર અને તાપમાનની અગત્યતા સમજવો. | 7 |
| | (ii) સંપૂર્ણ ગર્ભસંવર્ધન પ્રક્રિયા. | 7 |
| અથવા | | |
| | (i) પેશી સંવર્ધનનાં ફાયદા અને ગેરફાયદા સમજવો. | 7 |
| | (ii) પેશીસંવર્ધન પ્રક્રિયા વર્ણવો. | 7 |
| 3. | (i) બલૂન ફલાયમાં સંવનન વર્તણૂક સમજવો. | 7 |
| | (ii) ચામાચીડિયા અને ફુફામાં સહેશાખ્યવહાર સમજવો. | 7 |
| અથવા | | |
| | (i) સમજવો : પાઉલોવનો પ્રયોગ | 7 |
| | (ii) ફેરોમોન્સ વિશે નોંધ લખો. | 7 |
| 4. | (i) અરિય તેમજ બીમબવત વિખંડન વર્ણવો. | 7 |
| | (ii) મરધીના ગર્ભમાં ગર્ભકોષ્ઠન સમજવો. | 7 |
| અથવા | | |
| | (i) આહિલેખા નિર્માણ સમજવો. | 7 |
| | (ii) સસ્તનોના જરાયુની પેશીય સંરચના વર્ણવો. | 7 |

5. ટૂકમાં જવાબ આપો : (કોઈપણ સાત)
- (1) વ્યાખ્યા : વિષતા (ટોક્સીસિટી)
 - (2) EC₅₀ નો અર્થ શું થાય ?
 - (3) ચેતાવિષનાં ઉદાહરણ આપો.
 - (4) સેલ ગ્રો એટલે શું ?
 - (5) પેશીસંવર્ધનમાં CO₂ નાં ઉપયોગો જણાવો.
 - (6) અંગસંવર્ધન પદ્ધતિના પ્રકાર જણાવો.
 - (7) બ્રૂસ ઇફ્ફિક્ટ એટલે શું ?
 - (8) સંવનનની અગત્યતા શું છે ?
 - (9) સામાજિકતાનું મહત્વ લખો.
 - (10) શાળા સમજાવો : આનભન અને ભરોડ
 - (11) તનુકખંડ એટલે શું ? 33 કલાકના ભરધીના ભૂણમાં કેટલા તનુકખંડ હોય છે ?
 - (12) બાધ્ય ભૂણીયકલાઓના નામ આપો.
-

14

AE-130
April-2023
B.Sc., Sem.- VI
CC-310 : Zoology

Time : 2:30 Hours]

[Max. Marks : 70]

- Instructions :** (1) All questions are compulsory.
(2) Answer the questions with neat and labelled diagrams wherever necessary.

1. (i) Explain the routes of toxicants into animal body. 7
(ii) Describe any four factors affecting toxicity. 7

OR

- (i) Explain clinical and environmental toxicology. 7
(ii) Describe acute toxicity. 7

2. (i) Explain importance of Antibiotics, buffer and temperature in Tissue culture. 7
(ii) Whole embryo culture technique. 7

OR

- (i) Explain advantages and disadvantages of tissue culture. 7
(ii) Describe tissue culture techniques. 7

3. (i) Explain courtship behaviour in balloon fly. 7
(ii) Explain communication in bat and moth. 7

OR

- (i) Explain : Pavlov's experiment. 7
(ii) Write note on Pheromones. 7

4. (i) Explain radial and discoidal cleavage. 7
(ii) Explain blastulation in chick embryo. 7

OR

- (i) Explain primitive streak formation. 7
(ii) Describe histological structure of mammalian placenta. 7

5. Give answers in short : (Any **seven**)

14

- (1) Define : Toxicity
 - (2) What does it mean by EC₅₀ ?
 - (3) Give examples of neurotoxin.
 - (4) What is cell grow ?
 - (5) State uses of CO₂ in tissue culture.
 - (6) State the types of organ culture technique.
 - (7) What is Bruce effect ?
 - (8) What is importance of courtship ?
 - (9) Write significance of socialization.
 - (10) Explain the term : Flexure and torsion.
 - (11) What is somite ? How many somites found in 33 hours chick embryo ?
 - (12) Give name of extra-embryonic membranes.
-